



ગુજરાત જાહેર સેવા આયોગ

સેક્ટર ૧૦-એ, ઇ-૩ સર્કલ પાસે, ઇ રોડ, ગાંધીનગર - ૩૮૨૦૧૦

Phone No. (079) 23258980 Fax No. 23258400 Web Site: <https://gpsc.gujarat.gov.in>

અગત્યની સૂચના / Important Notice

(અરજી ફી, EWS Certificate તથા NCLC Certificate બાબતે)

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા.૧૫/૦૭/૨૦૧૯ ના રોજ જા.કઃ-૦૧/૨૦૧૯-૨૦ થી જા.કઃ ૧૨/૨૦૧૯-૨૦ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ઉક્ત જાહેરાત અન્વયે Online અરજી તા. ૩૧/૦૭/૨૦૧૯ ના સમય ૧૩:૦૦ કલાક સુધી <https://gpsc-ojas.gujarat.gov.in> પર અથવા <https://gpsc.gujarat.gov.in> પર આપેલ Apply On Line લિંક થી થઈ શકશે. ઉક્ત જાહેરાત અન્વયે બિન અનામત વર્ગના ઉમેદવારોએ ભરવાની થતી અરજી ફી Online અથવા પોસ્ટ મારફતે ભરી શકાશે. જે ઉમેદવારો Online અથવા પોસ્ટ મારફતે અરજી ફી તા. ૩૧/૦૭/૨૦૧૯ સુધીમાં ભરી શકશે નહિ, તેમણે આયોગની કચેરી (ગાંધીનગર) ખાતે રૂ.૫૦૦/- (પ્રોસેસિંગ ફી) ભરવાની રહેશે. આથી ઉમેદવારોને અરજી ફી તા.૩૧/૦૭/૨૦૧૯ નિયત સમય મર્યાદામાં ભરાઈ જાય તે માટે કાળજી લેવા જણાવવામાં આવે છે.

વધુમાં આર્થિક રીતે નબળા વર્ગો (EWS Category) ના ઉમેદવારો એ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા. ૨૫/૦૧/૨૦૧૯ ના ઠરાવ ક્રમાંક : ઇ.૬બલ્યુ.એસ/૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ થી નિયત થયેલ નમૂના (અંગ્રેજીમાં Annexure KH અથવા ગુજરાતીમાં પરિશિષ્ટ-ગ) માં મેળવેલ પાત્રતા પ્રમાણપત્ર (અર્થાત તેઓ EWS Category હેઠળ આવે છે તે મતલબનું પ્રમાણપત્ર) ના નંબર અને તારીખ ઓનલાઇન અરજી કરતી વખતે દર્શાવવાના રહેશે. આ પ્રમાણપત્ર તા.૨૫/૦૧/૨૦૧૯ કે ત્યાર બાદ અને અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ એટલે કે તા.૩૧/૦૭/૨૦૧૯ સુધીમાં Issue થયેલું હોય તોજ માન્ય ગણાશે.

ઉપરાંત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૨૬/૦૪/૨૦૧૬ ના ઠરાવ ક્રમાંક સશ્ચ/૧૨૨૦૧૫/૪૫૫૨૪૬/અ ની જોગવાઈ પ્રમાણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે ઉચ્ચ વર્ગ (Creamy Layer) માં સમાવેશ થતો ન હોવા બાબતનું Non Creamy Layer Certificate (NCLC) તા.૦૧/૦૪/૨૦૧૭ કે ત્યાર બાદ Issue થયેલું હોય તોજ માન્ય ગણવામાં આવશે. ઉપરાંત આ Non Creamy Layer Certificate અરજી સ્વીકારવાની છેલ્લી તા. ૩૧/૦૭/૨૦૧૯ કે તે પહેલા Issue થયેલું હોવું જોઈએ. અન્યથા તે માન્ય રાખવામાં આવશે નહિ.

તા. ૨૪.૦૭.૨૦૧૯